



મણિલાલ હ.પટેલની વાર્તાઓમાં સમાજદર્શન

ડૉ. નટવરસિંહ કે.થાકોર
મુ.પો.કુણધેર ,તા.જી.પાટણ ,પિન- ૩૮૪૨૫૫

ટૂંકીવાર્તા કે નવલિકા ભલે ટૂંકી કહેવાની પણ તેની અસર માનવીના ચિત્પર પર લાંબી રહે છે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય લેખક ધૂમકેતુએ માટે જ તેને “ વીજળીના ચમકારા ” જેવી કહીને નવાજી છે. મણિલાલ હ.પટેલનો વાર્તાસંગ્રહ – ‘ બાપાનો છેલ્લો કાગળ ‘ધૂમકેતુ ની વાર્તામાં શાખ પૂરે છે. ગુજરાતી કથાસાહિત્યમાં લોકજીવનના ધબકારને જીલવામાં મણિલાલ પટેલ પાવરધા કલાકાર છે. તેની પ્રતિતી બાપાનો છેલ્લો કાગળ વાંચતાં વાચકને સહેજેય થાય છે.

આ સંગ્રહની કુલ ૧૮ વાર્તાઓમાં માનવસંબંધોના તાણાવાના ગુંથાયેલા છે. મોટાભાગની વાર્તાઓ ગ્રામીણ જીવન જ પાયા પર ઉભેલી છે. ગામડાં લોકજીવન તેની નીતિરીતિ, વેદના, સામાજિક રીતરિવાજો, સામાજિક બંધનો વર્ગેનું નિર્દ્દિષ્ટ આ સંગ્રહમાં છે. લોકજીવનનો ધબકાર અને સામાજિક વાસ્તવ આ સંગ્રહના પન્ને ...પન્ને ડોકાય છે. તેની જબરી વિશેષતા તો એ કહે છે કે ...લોકજીવનના ધબકાર લેખક નરદમ લોકબોલીમાં અને લેહકમાં લઈ આવે છે. આભેદૂબ ગ્રામીણ જીવન તેણે અહીં અકશરો દ્વારા ઊભું કર્યું છે. લોકજીવનના રૂઢ થયેલા શબ્દો, કહેવતો, ગીતો, રૂઠિપ્રયોગોના ઉપયોગથી વાચકને ગ્રામીણજીવનની લગોલગ ઊભો કરી તે છે. લેખકની વાર્તા કહેવાની કરવાની શૈલી જ ગ્રામીણધૂળમાં રગાદોળાયેલી છે. જેમાં એકવાર વાચક પેઠા પછી માથાબુદ્ધ થઈ જાય છે. સંગ્રહનું શીર્ષિક જેના નામ પરથી પડ્યું છે તે વાર્તા “બાપાનો છેલ્લો કાગળ “ સંગ્રહની આઠમી વાર્તા છે. કાગળ પેન ના ઠેકાના નથી અને કાગળ લખતા લખતા આંખોમાં પાણી આવે, ધૂજે તેવા જીવનની કિનારીએ બેઠેલા એક વૃદ્ધ બાપા શહેર માં રહેતા પોતાના પુત્રને કાગળ લખે છે. વર્ષોથી શહેરમાં રહીને નોકરી કરતા દીકરા સાથે બેચીને શાંતિથી વાત કરવાનો મોકો જ મળ્યો નથી. જીવનની ઢાણી સાંજે જાણેકે કેટલાય ખુલાસા કરવા માટે તેઓ આ કાગળ લખી રહ્યા છે. શહેરમાં સુખી જીવન જીવતા દીકરાને ખરા સમયે ભાણુવામાં મદદ કરી ના શક્યો. ના વસવસો કે ના દુખ છે. તો સાથે સાથે પોતે વિતાવેલા દુખી જીવન અને સમાજજ્ઞાતિ ના તાણાવથી ઘસાઈ ગયેલા જીવનની વાત પણ બાપા કાગળમાં માડે છે. આજે બાપા જાણે હૈયું ઉધાડું કરીને બેઠા છે. તેઓ જાણે કે કદાચ આવતીકાલે નહીં હોય....

ખેંચાયેલો વરસાદ-વાર્તામાં વરસાદ ન આવવાથી ધરતી જેમ સુકાઈને વિવાવા માડે છે તેમ પ્રેમને ઝંખતી નાયિકા પોતાના બાળપણના ભેરુની રાહ જોતી છેવટે ભારે હેયે વિદ્યાય લે છે તેની લેખકે પ્રકૃતિના તન્વો નો સુંદર સમન્વય કર્યો છે. નાનપણમાં સાથે ભાણવા જતા ત્યારથી માડીને મેળામાં માણેલી મજાને વાગોલતી નાયિકા સીમામાં કામ કરતી જાય છે. તેનામાં રહેલી લાગણીની સીમામાં કામ કરતી જાય છે. તેનામાં રહેલી લાગણીની સચ્ચાઈ વાચકને ખળભળાવી મુકે તેવી છે. શહેરમાં રહી ભાણતો તેનો ભેરું તહેવારના દિવસોમાય આવતો નથી. ત્યારે મુંજાતી નાયિકા વિદ્યાય લે છે. સાસરી માથી તેહવા આવેલા માણુસની પાછળ રહીને તેના ભેરું વાડામાં જાય છે. કશુક ધૂટી ગયાનો વસવસો અને ભીની આંખે તે વિદ્યાય લે છે. ત્યારે લેખક લખે છે કે”મનુના ઉંબરે માથું ટેકવીને ધીમી પણ મક્કમ ચાલે ચાલી જતી પસીને આખું ફળિયું ભીની આંખે જોઈ રહ્યું....

આ ઉપરાંત “પડતર અને બાવળના કુલ જેવી વાર્તામાં સામાજિક રૂઢીઓ તથા સામાજિક-આર્થિક કારણો સર અતૃપ્ત અને હુદ્દ વિના જીવન ધરી ની વાત છે. સંગ્રહની તમામ વાર્તાઓ માનવી સ્વભાવની અને તેના મનની સંકુલતા ને વર્ણવે છે. અતૃપ્તિ અને અભાવ જાણે સંગ્રહનો પ્રાણ વાયુ બની જાય છે. ‘વિચ્છેદ’ જેવી વાર્તામાં સમાજનું આભેદૂબ ચિત્ર લેખક આપે છે. ભાણેલા-ગણેલા અને પોતાની જાતને સુધારેલા કહેતા શહેરમાં રહેતા લોકો પણ કેવું કુંઠિત અને સંકુચિત જીવન જીવે છે. તેનું

નિરૂપણ આ વાર્તામાં છે. ગ્રામીણ જીવનના સંસ્કાર, આવકાર અને માનવતા ને કોરે મૂકી ડે છે. સગી બહેનને પોતાના પિતાના મરણ સમયે પણ ધરમાં ના આવવા દેતા, ના મળવા દેતા સમાજનું વરવું ચિત્ર આ વાર્તામાં લેખકે દોર્યું છે.

‘મગન સોમાની આશા’ વાર્તામાં ગામડામાં રહેતા પિતા પોતાનું ઘર સાજું કરવા કે આર્થિક સંકડામણમાથી છૂટવા પોતાની દીકરીનો પૈસામાં સોદો કરે છે. મનથી જેને પણ નથી માંથી તેવી આશા છેવટે સાસરું છોડી રાતે ભાગી નીકળે છે. ભીષણ રાત્રીમાં તેનું જીવન અંધકારમાં અલોપ થઈ જાય છે. “ખારાપાટ ‘જેવી વાર્તામાં પણ માનવીય સંબંધો અને પ્રેમ જંખતા માનવીની વાત કરવામાં આવી છે.

આ વાર્તા સંગ્રહની વિશેષતા તેની રજૂઆત છે. ગામડાનાં જીવન ની વાસ્તવિકતા અને સામાજિક રૂઢીઓ સાથે ગામડાનું સચેતન અને પરંપરા થી ધબકતું જીવન તેમાં વર્ણવાયેલું છે. ગામડાનું ખોટું નહીં પણ વાસ્તવિક ચિત્ર એક સંવેદનશીલ સર્જકની નજરે નિહાળવું તેમાં એક હાવો છે. ગામડા ના લોકોની સમસ્યાઓ, પ્રશ્નો સર્જકતાથી તીખા બનાવ્યા વિના સુંદર શૈલીમાં વર્ણવી લેખક વાચકોને પોતાનો સંદર્શો પહોંચાડે છે. વિવિધ ઝાતુઓ, વનસ્પતિ, ખેતીના પાકો, જમીન, વણાખેડાયેલી જમીન પડતર, પાણી, નદી, પર્વત જેવા કુદરતી તત્વોનો ગ્રામીણ જીવન સાથેનો નાતો અને લોકજીવનમાં વણાઈ ગયેલા આ તત્વોનું મહત્વ પણ એક રીતે લેખક દર્શાવે છે. લોકબોલીમાં લખાયેલી આ વાર્તા એ વિષય માં વિવિધ સ્વરૂપોને લોકબોલીમાં પ્રગટ કરે છે. આ લોકબોલી વાતાવરણ રચવામાં તીર જેવી સાબિત થાય છે. સંગ્રહની એક આખી વાર્તા વાંચ્યા પછી વાચક આંચકો અનુભવે છે. તેમાં ભારોભાર છે.

સંદર્ભ સૂચિ

1. બાપાનો છેલ્લો કાગળ વાર્તા સંગ્રહ